

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ખૈરુલ અનામે મોહમદુન વ વસીયોહુ --- خَيْرُ الْإِنَامِ مُحَمَّدٌ وَوَصِيئُهُ
વલ બરતુઝ ઝહરાઓ વલ હસનાની --- وَالْبِرَّةُ الرَّهْرَاءُ وَالْحَسَنَانِ

મોહમદ રસૂલુલ્લાહ (સઅવવ) આપના વસી (મૌલાના અલી સ.અ.) અલ બરતુઝ ઝહરા (મૌલાતોના ફાતેમતુઝ ઝહરા સ.અ.)
અને હસનાન (મૌલાના ઇમામ હસન અને હુસૈન સ.અ.) ખલ્ક ના ખૈર છે (તમામ કરતા બેહતર છે)

The Best of the World are Mohammad SAWS, and His Wasi Maulaana 'Ali SA, and the virtuous
Zahra SA and Maulaana Imaam Hasan SA and Maulaana Imaam Husain SA (together called as
Hasanaan)

કૌમુન બેહિમ કોશેફલ અમા વ બેહદયેહિમ --- قَوْمٌ بِهِمُ كُتِفَ الْعَمَىٰ وَبِهَدْيِهِمْ
હોદેયલ વરા મિન હૈરતે તુગયાની --- هُدَى الْوَرَىٰ مِنْ حَيْرَةِ الطَّغْيَانِ

યે સઘલા એ સાહબો છે કે જેના સબબ અંધાપો દૂર થાય છે (જેહાલત દૂર થાય છે) અને યે સઘલા ની હિદાયત ના સબબ
તુગયાની ની હૈરત થી (ઝુલ્મ થી) આલમ ને હિદાયત મિલે છે

They have removed the Darkness (of Ignorance) and Guided the World (towards the Righteous
Path) away from the baffling chaos

મન લા તતિમ્મો સલાતોના ઇલા બેહિમ --- مَنْ لَا تَتِمُّ صَلَاتُنَا إِلَّا بِهِمْ
વ બેહિમ યોનાદી વક્ત કુલ્લે અઝાની --- وَبِهِمْ يُنَادِي وَقْتَ كُلِّ آذَانٍ

(ખમસતુલ અત્હાર સ.અ.) તે સાહબો છે કે જેના બગૈર હમારી નમાઝો તમામ થાતી નથી અને એમના સબબ અઝાન ની
નિદા કરવામાં આવે છે

Without them (their Walaayat) our Namaaz is incomplete (not accepted by Allaah Ta'aala) and
because of them the Azaan is said

ખોઝ્કાનો ઇલ્મિલાહે મહબતો વહયેહી --- خُرَّانُ عِلْمِ اللَّهِ مَهْبِطٌ وَحِيهِ
વલ મૌઝેહૂના શરાએઅલ ઇમાની --- وَالْمَوْضِحُونَ شَرَائِعَ الْإِيمَانِ

યે સાહબો ખુદા ના ઇલ્મ ના ખોઝ્કામ છે (હિફ્ઝત કરનાર છે), ખુદા ના વલ ઉતરવાની જગહ છે અને ઇમાન ના શરાએઅ
(રસ્તાઓ) ને વાઝેહ કરનાર છે (બતાવનાર છે)

They are the Guardians of the Treasures of Allaah's Knowledge, the receptors of the Wahi, and the
Ones who shows the tenets of Imaan

Ad Da'watul 'Alaviyah - 45th Da'i e Mutlaq Saiyedna Haatim Zakiyuddin Saheb TUS. Download "Ahl uz Zikr" - An exclusive mobile
application for Alavi Bohras, for Deeni Ma'loomaat and all information of Jamaa'at. Available on Android and iOS.

હબલવ એલાહો ફમન તઅલ્લકહૂ નજા --- حَبْلُ الْإِلَهِ فَمَنْ تَعَلَّقَهُ نَجَا ---
વહવા મોખાલેફૂહૂ એલવ ખુસરાની --- وَهُوَ مُخَالِفُهُ إِلَى الْخُسْرَانِ ---

યે સઘલા અલ્લાહ તઆલા વા હબ્લ છે (રસ્સી છે), જે શખ્સ યે હબ્લ થી વળગે તો નજાત હાસિલ કરે અને મુખાલેફૂત કરનાર (ઇનકાર કરનાર) ખોટમાં વાકેઅ થાનાર છે

(They are) the Rope of Allaah Ta'aala; he who holds the Rope will get Najaat and he who opposes it will Sink

આઅ્લામો દીનિલ્લાહે અરકાનુલ હોદા --- أَعْلَامُ دِينِ اللَّهِ أَرْكَانُ الْهُدَى ---
સોફોનુન નજાતે દઆએમુલ ઇમાની --- سُنُنُ النَّجَاتِ دَعَائِمُ الْإِيمَانِ ---

યે સઘલા અલ્લાહ ના દીન ના આઅ્લામ છે (ઝંડાઓ) છે, હિદાયત ના અરકાન (હિસ્સા) છે, નજાત ના સફીના છે, ઇમાન ના દેઆમત (થાંભલાઓ) છે

(They are) the Flags of Allaah Ta'aala's Deen, the cornerstone of Hidaayat, the Arks of Najaat and the Pillars of Imaan

વલકદ વકફતો બે કરબલાઅ ફજદદત --- وَلَقَدْ وَكَّفْتُ بِكَرْبَلَاءَ فَجَدَّدْتُ ---
કરબી વ અઝકત ફીલ હશા આહઝાની --- كَرْبِي وَأَذَكْتُ فِي الْحَشَا أَحْزَانِي ---

તેહકીક (હકીકત છે) જે વકત હૂં કરબલા માં ઠેહરો તો કરબલાએ મારા દર્દને તાઝા કરી દીધો અને દિલ માં હુઝ્ન (ગમ) ની આગને ભડકાવી દીધી

I stood in Karbala and my Grief was renewed and the Fire of my Sorrow ignited within me

વ ઝકરતો ફી આશૂરાએ મસરઅ સૈયેદી --- وَذَكَرْتُ فِي عَاشُورَاءِ مَصْرَعِ سَيِّدِي ---
અસફ્ન અલા મૌલાયા ઝીલ અતશાની --- أَسْفًا عَلَى مَوْلَايَ ذِي الْعَطْشَانِ ---

અને આશૂરા ના દિન મારા મૌલા (ઇમામ હુસૈન) ની શહાદત થઈ છે તે યાદ આવી ગઈ, અજબ મારો પસ્તાવો તે પ્યાસાઓ ઉપર

And I recalled my Imaam's Martyrdom in Aashura, great is my Regret for his burning Thirst

વ લઅબકેયત્ર અલલ હુસૈને વ સહબેહી --- وَلَأَبْكِيَنَّ عَلَى الْحُسَيْنِ وَصَحْبِهِ ---
બેદમિન વ દમઇન દાએમિન હતાની --- بَدِمٍ وَدَمِعٍ دَائِمٍ هَتَّانِ ---

અને હર આઇના (હર વકત) તેહકીક હૂં મૌલાના ઇમામ હુસૈન અને આપના અસહાબ પર ખૂનનાં આંસુ થી રોતો રહીશ અને એવા આંસુ કે જે હંમેશા ટપકતાજ રેહશે

And I will keep on weeping Bloody Tears on Maulaana Imaam Husain SA and his Companions;
and Tears that will flow ever

વ લઅબકેયત્ર અલલ કતીલે બેકરબલા --- وَلَا بُكَيْنَ عَلَى الْقَتِيلِ بِكَرْبَلَا
ઉર્થાના મતરૂહન બેલા અકફાની --- عُرْيَانَ مَطْرُوحًا بِلَا أَكْفَانَ

અને હર આઈના (હર વકત) તેહકીક હૂં વો શહીદ પર રોતો રહીશ કે જે કરબલામાં બે-કફન ગિરા હુઆ છે

And I weep for the Martyrs of Karbala lying without Kafan (on the ground)

વ લઅબકેયત્ર અલા બનાતે મોહંમદિન --- وَلَا بُكَيْنَ عَلَى بَنَاتِ مُحَمَّدٍ
મસબીયતિન બિઝ્ઝુલમે વલ ઉદવાની --- مَسْبِيَّةً بِالظُّلْمِ وَالْعُدْوَانِ

અને હર આઈના (હર વકત) તેહકીક હૂં મોહંમદ (સ.અ.વ.વ) ના તે શેહઝાદિયો પર રોતો રહીશ કે જે સઘલા પર ઝુલ્મો
સિતમ કરીને બંદીવાન (કૈદીઓ) કરવામાં આવા છે

And I weep for the daughters of the House of Mohammad SAWS enslaved in oppression and
hostility by wicked enemies

વ લઅબકેયત્ર અલા ગરીબે મોહંમદિન --- وَلَا بُكَيْنَ عَلَى غَرِيبٍ مُحَمَّدٍ
બિત્તફૂફે ફરદન નાઝેહલ ઔતાની --- بِالطَّفِّ فَرْدًا نَازِحَ الْأَوْطَانِ

અને હર આઈના (હર વકત) તેહકીક હૂં મોહંમદ (સ.અ.વ.વ) ના તે પરદેશી (બે-વતન) પર રોતો રહીશ કે જે કરબલામાં
તને-તન્હા વતન થી દૂર છે

And I weep for the Mohammad SAWS's Son who was Stranger in Taff, alone and far from his
Homeland

મા ઉઝરો કાતિલે અહલે બૈતે મોહંમદિન --- مَا عَذْرُ قَاتِلِ أَهْلِ بَيْتِ مُحَمَّدٍ
ફિલ હશરે ઇન્દલ વાહેદિલ મન્નાની --- فِي الْحَشْرِ عِنْدَ الْوَاحِدِ الْمَنَّانِ

હશરના દિન અહ્લાહ તઆલા ના નઝદીક એહલે બૈતે મોહંમદ (સ.અ.વ.વ) ના કાતિલો નો શું ઉઝર (બહાનો) હશે? કોઈ
ઉઝર હશે જ નહી

What excuse will the Killers of Ahl ul Bayt SA, Mohammad SAWS's children offer Allaah Ta'aala on
the Day of Qeyaamah?

મા-અહ્લાહો અન ઝુલ્મિલ એબાદે બેગાફેલિન --- مَا اللَّهُ عَنِ ظُلْمِ الْعِبَادِ بِغَافِلٍ
લકિન લહમ યૌમુન અઝીમુશ શાની --- لَكِنَّ لَهُمْ يَوْمَ عَظِيمِ الشَّانِ

અલ્લાહ તઆલા એબાદ ના (એનાં બંદાઓ) ના ઝુલ્મ થી ગાફિલ નથી, મગર યે સઘલા (ઝાલિમો) વાસ્તે એક અઝીમુશ શાન દિન (કેયામત નો દિન) મુકરર છે

Allaah Ta'aala is not ignorant of the Injustice done to his Servants, they'll have their Day - the Day of Great Importance

સલ્લલ એલાહો અલત્રબીયે વ આલેહી --- صَلَّى الْإِلَهُ عَلَى النَّبِيِّ وَالْأَهْلِ ---
મા ગરદલ કુમરીયો ફિલ અગસાની --- مَا غَرَدَ الْقُمْرِيُّ فِي الْأَغْصَانِ ---

અલ્લાહ તઆલા મોહંમદ મુસ્તફા (સ.અ.વ.વ) અને આપના ફરઝંદો - અહમ્મતે તાહેરીન (સ.અ.) ના ઉપર સલવાત પઢજો જહાં તક ડાલિયો પર કુમરી પરિંદા ચહેકતા રહે

Allaah Ta'aala's Salawaat on the Mohammad SAWS and His Progeny for as long as the Canary sings on the (branches of) Trees
